



**NBK-001-001276**      Seat No. \_\_\_\_\_

**B. A. (Sem. II) (CBCS) Examination**

**April / May – 2017**

**Geography : Paper - IV**

*(Man & Environment System)*

*(Elective - I) (Old Course)*

**Faculty Code : 001**

**Subject Code : 001276**

Time :  $2\frac{1}{2}$  Hours]

[Total Marks : 70]

- Sૂચના : (૧) બધા પ્રશ્નો ફરજિયાત છે.  
 (૨) જરૂર જણાય ત્યાં સ્વચ્છ આકૃતિ દોરો.

૧ માનવ અને પર્યાવરણ સંબંધનો ઈતિહાસ વિગતે સમજાવો. ૧૪

**અથવા**

૧ પરિસ્થિતિકીય તંત્રનો ઘ્યાલ સમજાવી, પર્યાવરણમાં નાઈટ્રોજન ચકની વિગતે ચર્ચા કરો. ૧૪

૨ પર્યાવરણ અભ્યાસના અભિગમ્ભો વિગતવાર વર્ણવો. ૧૪

**અથવા**

૨ શહેરીકરણની પર્યાવરણ પર થતી અસરો વિગતે સમજાવો. ૧૪

૩ પ્રદુષણ એટલે શું ? પ્રદુષણના વિવિધ પ્રકારોની વિગતે માહિતી આપો. ૧૪

**અથવા**

૩ પર્યાવરણની માનવ પ્રકૃતિ ઉપર થતી અસરોની વિગતવાર ચર્ચા કરો. ૧૪

૪ પરિસ્થિતિકીય વિજ્ઞાનની વ્યાખ્યા આપી, તેનું વર્ગીકરણ વિગતે સમજાવો. ૧૪

**અથવા**

૪	ટેક્નોલોજીના વિકાસને કારણે પર્યાવરણમાં આવેલા બદલાવો ઉદાહરણ સાથે સમજાવો.	૧૪
૫	નોંધ લખો : (ગમે તે બે)	૧૪
	(1) પર્યાવરણ ભૂગોળનું કાર્યક્ષેત્ર (2) ફુદરતી આફતો (3) પર્યાવરણીય પ્રબંધન (4) પર્યાવરણનું સંરક્ષણ.	

### ENGLISH VERSION

**Instructions :**

- (1) All questions are compulsory.
- (2) Draw neat diagram wherever necessary.

**1** Explain in detail the history of Man and environment relationship. **14**

**OR**

**1** Explain the concept of ecosystem, discuss in detail the nitrogen cycle in environment. **14**

**2** Describe in detail the approaches of environmental studies. **14**

**OR**

**2** Explain in detail the effects of urbanization on environment. **14**

**3** What is pollution ? Give a detail information of various types of pollution. **14**

**OR**

**3** Discuss in detail the effects of environment on human being. **14**

**4** Give the definition of ecology and explain in detail its classification. **14**

**OR**

**4** Explain with example the changes in environment due to development of technology. **14**

**5** Write notes on : (any two) **14**

- (1) Scope of environment geography
  - (2) Natural hazards
  - (3) Environmental management
  - (4) Conservation of environment.
-